

બં. અ કૃષિ મહાવિદ્યાલયના વિદ્યાર્થીની બાયર સેફ યુઝ એમ્બેસેડર તરીકે જર્મનીની મુલાકાતે

જવાની પસંદગી

બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતે બીએસસી (કૃષિ)ના સાતમાં સત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે “સ્ટુડન્ટ રેડી પ્રોગ્રામ” કાર્યક્રમનું સત્ર દરમ્યાન વિવિધ વિભાગોમાં વિદ્યાર્થીઓની કૃષિમાં કુશળતા વધે તે માટે સીધા જ પ્રધાનમંત્રી, ભારત સરકારના માર્ગદર્શન અને મદદથી ચાલી રહ્યો છે. ચાલુ વર્ષ ૨૦૧૮-૧૯માં કીટકશાસ્ત્ર વિભાગ દ્વારા વિભાગની અને જુદા જુદા સંશોધન કેન્દ્રોની કીટકશાસ્ત્રને અનુરૂપ કામગીરી કઈ રીતે થાય છે તે અંગેનો પ્રાયોગિક અભ્યાસ કરાવવામાં આવે છે. ઉપરાંત, જંતુનાશક બનાવતી કંપની અને સ્વૈછીક સંસ્થાઓ (NGO)માં કીટકશાસ્ત્રને ધ્યાનમાં રાખી તેની પ્રવૃત્તિઓથી અવગત કરાવવામાં આવે છે. બાયર કોપ સાઈન્સ કંપનીને વિદ્યાર્થીઓના વિકાસ માટે અને ખેડૂતોને ભવિષ્યમાં ઉપયોગી થઈ શકે તે ધ્યાનમાં આખી એક દિવસનો “બાયર સેફ યુઝ એમ્બેસેડર પ્રોગ્રામ” તા. ૨૪.૦૭.૨૦૧૯ના રોજ રાખવામાં આવેલ જેમાં બૌદ્ધિક અને પ્રાયોગિક રીતે જંતુનાશકોના વપરાશ અંગે સંપૂર્ણ માહિતી વિભાગના શિક્ષકો અને બાયર કંપનીના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ હતી. આ માહિતીના આધારે વિદ્યાર્થીઓ જ્યારે ખેડૂતોની મુલાકાતે જાય ત્યારે તેમની સાથે કરેલ વાર્તાલાપની વિડીયો ક્લિપ તૈયાર કરવાની હતી અને જેટલા ખેડૂતોનો સંપર્ક કરેલ હોય તેમના નામ અને સંપર્ક નંબરનું લીસ્ટ તૈયાર કરી ટૂંકી માહિતીનો અહેવાલ તૈયાર કરવાનો થતો હતો. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ વિગત બાયરની વેબસાઈટ ઉપર તેમની સૂચના મુજબ અપલોડ કરવાની હતી. ભાગ લીધેલા ૭૯ વિદ્યાર્થીઓ અને ૨૫ વિદ્યાર્થીનીઓ મળી કુલ ૧૦૪માંથી ત્રણ વિદ્યાર્થીઓ (નિમેષ ગોરાણી, પાર્થ ચોટાલીયા અને પાર્થ પટેલ)ની સંપૂર્ણ માહિતી બાયરની વેબસાઈટ ઉપર અપલોડ કરેલ હતી, જેનું બાયરના ભારત અને જર્મન સ્થિત અધિકારીઓ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં ભારતની કુલ પાંચ યુનિવર્સિટીની પાંચ મહાવિદ્યાલયો (૧. બં. અં. કૃષિ મહાવિદ્યાલય, આકૃયુ, આણંદ, ૨. વીએનએમકેવી, પરભણી, મહારાષ્ટ્ર, ૩. કૃષિ મહાવિદ્યાલય, બરામતી, મહારાષ્ટ્ર, ૪. ઉત્તર બાંગલા કૃષિ મહાવિદ્યાલય, પુંદેરી, પશ્ચિમ બંગાળ, ૫. બીપીએસ કૃષિ મહાવિદ્યાલય, બિહાર કૃષિ યુનિવર્સિટી, સાબોર, પુર્નીયા, બિહાર)ના ૬૧૬ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતાં જેમણે ૭૪૩૦ ખેડૂતોનો સંપર્ક કરી માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનો અને સમજાવવાનો પ્રયત્ન કરેલ. ગર્વ સાથે જણાવતા આનંદ થાય છે કે, બં. અ. કૃષિ મહાવિદ્યાલયના હાલ બીએસસી (કૃષિ)ના આઠમાં સત્રમાં અભ્યાસ કરતા નિમેષ જે. ગોરાણીની પસંદગી “બાયર સેફ યુઝ એમ્બેસેડર” તરીકે થઈ છે. તેમને વધુ માહિતી મળી રહે અને સારી જાણકારી મળે તે માટે નિમેષ આશરે ૧૧ મે થી ૧૭ મે, ૨૦૧૯ દરમ્યાન જર્મની ખાતેની બાયર કોપ સાઈન્સ કંપનીના હેડક્વાર્ટર ખાતે કંપનીના ખર્ચે બાયરના “સેફ યુઝ એમ્બેસેડર” એજ્યુકેશનલ વર્કશોપમાં સામેલ થાય એવું આમંત્રણ પણ મળેલ છે. જેઓ તમામ પાકની સુરક્ષા કરતી

પ્રોડક્ટસના જવાબદાર ઉપયોગ અંગેના શિક્ષણ માટે તેની સાથે જોડાશે. વર્કશોપ ઉપરાંત, તેમના આ પ્રવાસમાં બાયર આરએન્ડડી સુવિધાની મુલાકાત તથા બાયર એક્સપર્ટ સાથેની વાતચીત સામેલ છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. એન. સી. પટેલ, બાયર સેફ યુઝ એમ્બેસેડર પ્રોગ્રામ અંગે જણાવતા એગ્રો કેમિકલ્સના સુરક્ષિત ઉપયોગ અંગે કૃષિ વિદ્યાર્થીઓને શિક્ષિત કરવાના બાયરના આ કદમની પ્રંશસા કરી હતી.

આ સમગ્ર નવીનતમ કાર્યક્રમ છેલ્લા બે વર્ષથી કીટકશાસ્ત્ર વિભાગમાં પૂરા ઉત્સાહ અને ઉમંગથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરી ચલાવવામાં આવે છે. જેની ફલશ્રુતિ સ્વરૂપે સતત બે વર્ષથી આ ઐતિહાસિક મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ આંતર રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામી વિદેશની ધરતી પર આ મહાવિદ્યાલયનું પ્રતિનિધીત્વ કરેલ છે તે મહાવિદ્યાલયનું ગૌરવ ગણી શકાય. આ ગૌરવ અપાવવા માટે કીટકશાસ્ત્ર વિભાગના વડા ડૉ. પી. કે. બોરડ અને ડૉ. ડી. બી, સિસોદીયા, ડૉ. આર. કે. કુમર, ડૉ. સી. બી. ધોબી, પ્રો. મીરલ સુથાર, કુ. મિનાક્ષી લુણાગરીયાએ અને વિભાગના સ્ટાફે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરી ભારે જહેમત ઉઠાવેલ જે વિભાગનું તેમજ મહાવિદ્યાલયનું ગૌરવ ગણી શકાય.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અને અનન્ય સિધ્ધી હાંસલ કરવામાં આચાર્ય અને વિદ્યાશાખાધ્યક્ષશ્રી ડૉ. એમ. વી. પટેલ, નિવૃત્ત આચાર્ય અને વિદ્યાશાખાધ્યક્ષશ્રી ડૉ. કે. પી. પટેલ અને સ્ટુડન્ટ રેડી પ્રોગ્રામનું સંકલન સંભાળતા વિસ્તરણ શિક્ષણ વિભાગના વડા ડૉ. એન. બી. ચૌહાણ સતત પ્રેરણાના સ્ત્રોત રહ્યા છે.

